



ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ.૦૧

તા.૦૮.૦૧.૨૦૧૮

કોંગ્રેસ પહેલાં જતિવાદ, કોમવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાની વિચારધારા બંધ કરે તો તે
“ભગવાનશ્રી રામને ભજવાં કે પૂજવાં” બરાબર છે – ભરત પંડ્યા

ભગવાનશ્રી રામનું અસ્તિત્વ નથી તેમ કહેનાર અને અયોધ્યામાં રામ મંદિર ન બને તે માટે કાવા-દાવા કરનાર
કોંગ્રેસનો વિચાર-આચાર એ “મુખ મેં રામ ઓર ભગલ મેં છૂરી” જેવો છે – ભરત પંડ્યા

કોંગ્રેસની વિચારધારા “તળિયા વગરના લોટા” જેવી છે. કોંગ્રેસ જ્યાં સત્તામાં હોય છે ત્યાં ભયંકર ભ્રષ્ટાચાર કરે છે અને
જ્યાં સત્તામાં નથી હોતી ત્યાં દંભ, જૂઠ્ઠાણાં અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે

કોંગ્રેસ માત્ર “નહેરુ-ગાંધી પરિવાર”માં જ માને છે. જે પરિવારે ૩૮ વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી પદ ભોગવ્યું હતું.
જ્યારે ભાજપ “વસુદેવ કુટુંબકમ્” ની ભાવના સાથે “વિશ્વને એક પરિવાર” માને છે

ભાજપ પ્રદેશ પ્રવક્તાશ્રી ભરત પંડ્યા એ જણાવ્યું હતું કે, ભગવાનશ્રી રામ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે.
આખો દેશ ભગવાનશ્રી રામને માને છે અને પૂજે છે. કોંગ્રેસ પણ હવે, તેમને માનવા લાગીને કાર્યક્રમો આપવાનો
પ્રયાસ કરે છે. તે ખોટું નથી, સારી વાત છે. પરંતુ કોંગ્રેસનો ઈરાદો માત્ર રાજકીય અને નાટકીય છે. એક બાજુ કોંગ્રેસ
ભગવાનશ્રી રામનું અસ્તિત્વ જ નથી, તે કાલ્પનીક પાત્ર છે તેમ કહે છે. કોંગ્રેસના કપીલ સિંબલ રામમંદિર જલ્દી ન
બને તે માટે કોર્ટમાં ૨૦૧૯ પછી રામમંદિરનો ચૂકાદો આવે તેમ કહે છે. એટલે અયોધ્યામાં રામ મંદિર ન બને તેવા
કોંગ્રેસના કાવા-દાવા રહ્યાં છે.

શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, દેશમાં એક પછી એક રાજ્ય માંથી કોંગ્રેસ સતત હારતી જાય છે. ગુજરાત અને
દેશની જનતા જાણે છે કે, કોંગ્રેસની વિચારધારા “તળિયા વગરના લોટા” જેવી છે. કોંગ્રેસ જ્યાં સત્તામાં હોય છે ત્યાં
ભયંકર ભ્રષ્ટાચાર કરે છે અને જ્યાં સત્તામાં નથી હોતી ત્યાં દંભ, જૂઠ્ઠાણાં અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે.
કોંગ્રેસ પહેલાં જતિવાદ, કોમવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાની વિચારધારા બંધ કરે તો તે “ભગવાનશ્રી
રામને ભજવાં કે પૂજવાં” બરાબર છે.



ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્




પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

//૨//

શ્રી પંડ્યાએ જાણાવ્યું હતું કે, કોંગ્રેસનો વિચાર-આચાર એ **“મુખ મેં રામ ઓર બગલ મેં છૂરી”** જેવો છે. કોંગ્રેસ જે.એન.યુ.ના કેટલાક લોકોની રાષ્ટ્ર વિરોધી, હિન્દુત્વ વિરોધી કાર્યક્રમોમાં જાય છે. તેવાં લોકોને પ્રોત્સાહન આપે છે. કોંગ્રેસ મુસ્લિમ મહિલાઓની સમાનતા, માનવતા, સન્માન અને આર્થિક-સામાજિક સુરક્ષા માટેનાં **“તલાક”** બિલનો વોટ બેંકની રાજનીતિને કારણે રાજ્યસભામાં વિરોધ કરે છે. કોંગ્રેસ એકબાજુ બંધારણ વિરૂદ્ધ કોઈ સમાજને ઓ.બી.સી.માં અનામત આપીશું તેવા જૂઠ્ઠાણાં ફેલાવે છે અને બીજી બાજુ ઓ.બી.સી.ના બંધારણીય દરજ્જાના બિલનો સંસદમાં વિરોધ કરે છે. એકબાજુ પોતાના કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 1% ઈ.બી.સી.(આર્થિક પછાત વર્ગ) જાહેર કરતી નથી અને અહીં 20% ઈ.બી.સી.આપવાના જૂઠ્ઠાણાં ફેલાવ્યાં હતાં. કોંગ્રેસ એટલે દંભ, જૂઠ્ઠાણાં, ભ્રષ્ટાચાર અને અરાજકતા ફેલાવનારી પાર્ટી.

શ્રી પંડ્યાએ જાણાવ્યું હતું કે, ભાજપ માટે હિન્દુત્વ એ સંસ્કૃતિ, પરંપરા અને સત્યતા છે. કોંગ્રેસ માટે એ રાજકીય દંભ હોઈ શકે છે. પરંતુ ભાજપ માટે હિન્દુત્વ એ જીવનશૈલી છે. હિન્દુત્વ એટલે સત્ય, પ્રેમ, કડ્ડણા, સામાજિક સમરસતા અને માનવતા છે. ભાજપ માટે હિન્દુત્વ એટલે સર્વધર્મ સમભાવ છે, સૌનો સાથ-સૌનો વિકાસ છે. કોંગ્રેસ એ માત્ર નહેરુ-ગાંધી પરિવારમાં જ માને છે. જે પરિવારે 38 વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી પદ ભોગવ્યું હતું. જ્યારે ભાજપ **“વસુદેવ કુટુંબકમ્”** ની ભાવના સાથે **“વિશ્વને એક પરિવાર”** માને છે. ભગવાનશ્રી રામનું અસ્તિત્વ નથી. તેમ કહીને રામ મંદિર ન બને તેવા કાવા-દાવા કરનાર કોંગ્રેસને ભાજપ માટે કંઈ કહેવાનો અધિકાર નથી. **“વંદેમાતરમ્, મરજ્યાત હોવું જોઈએ”** તેવું કહેનાર કોંગ્રેસને દેશભક્તિના સંદર્ભમાં ભાજપને સલાહ દેવાનો કોઈ અધિકાર નથી. તેમશ્રી પંડ્યાએ અંતમા ઉમેર્યું હતું.


(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર - મીડિયા સેલ